

## APPENDIX D

### A lecture delivered at the knowledge input programme (Gujarati)

મિત્રો, આજે આપણે થોડી રસપ્રદ વાતો કરીશું. ૨૭૮ અપગ વ્યક્તિઓના સર્વક્ષણ ઉપરથી કેટલાક ખૂબ રસપ્રદ તારણો મળ્યા છે. આ તારણો છે તે તમારી જેવી દરેક અપગ વ્યક્તિની વાચા છે અને તમારા બધાને સહીયારો અવાજ પણ છે. આના ઉપરથી તમને અનુભવાતી મુશ્કેલીઓની અમને જાણ થઈ.

આમ હોઈએ તો અપગ વ્યક્તિ સૌ પ્રથમ એક વ્યક્તિ છે. અને ત્યાર પણી તે અપગ હોઈ શકે. એક વ્યક્તિ તરીકે એક ગ્રાહક પણ છે જ. આપણે સહુ નાની મોટી કેટલીયે ખરીદી કરતા હોઈએ છીએ. અને જ્યારે જ્યારે આપણે બજારમા ખરીદી કરતા હોઈએ ત્યારે ત્યારે આપણે એક ગ્રાહકની જેમ વર્તતા હોઈએ છીએ અને આપણે ગ્રાહકના હક્કોનો ઉપયોગ કરતા હોઈએ છીએ.

હા, અપગ વ્યક્તિને પણ ગ્રાહક તરીકે એ જ બધા હક્કો મળે છે જે એક સામાન્ય વ્યક્તિને મળે છે. વર્ષ ૧૯૮૮ના ગ્રાહક સુરક્ષા ધારા અતર્ગત એક ગ્રાહક તરીકે અપગ કે સામાન્ય વ્યક્તિ વચ્ચે કોઈ બેદરેખા રાખવામા આવી નથી. પરંતુ, ગ્રાહકના હક્કોનો ઉપયોગ કેવી રીતે થઈ શકે અને ગ્રાહકોને કયા હક્કો મળેલા છે એ વિશે વધારે વાત કરીએ એ પહેલા આપણે એ જાણી લઈએ કે અપગોની મુશ્કેલીઓ ઓછી કરવા સરકારે કયા કયા લાલો જાહેર કર્યા છે. એક અપગ વ્યક્તિએ આ લાલો માત્ર જાણવા જ જરૂરી નથી, પરંતુ તેનો ઉપયોગ કરવો એ અપગોનો અધિકાર છે.

આજે હું તમને સામાન્ય રીતે વધારે ઉપયોગી છે તેવા મહત્વના કેટલાક લાલો વિશેની જાણકારી આપીશ. આ લાલોને મુખ્યત્વે ચાર વિભાગમા વ્લેચી શકાય. મુસાફરીને લગતા, બણતરને લગતા, રોજગારીને લગતા અને સાધન-સહાયને લગતા. આમા સૌ પ્રથમ મુસાફરીને લગતા લાલો લઈએ તો તે આ મુજબ છે. અપગોને લઘુત્તમ દરની ટિકિટથી શહેરી બસ સેવામા મુસાફરીનો લાલ, તેમને માટે બસમા આરક્ષિત બેઠકો, જેમ કે બેઠક નબર ૨૫, ૨૬ અને ૨૭. એસ.ટી.ની બસ સેવામા ભાડામા રાહત. ઉપરાત ૭૫ ટકા કે તેથી વધુ અપગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સાથીદારને ફર્સ્ટ કલાસ અને સેકન્ડ કલાસ રેલ્વે મુસાફરીમા ભાડામા ૭૫ ટકાની રાહત પણ મળે છે.

બણતરને લગતા લાલો જોઈએ તો તે આ પ્રમાણે છે: અમુક શરતોને આધિન, ધોરણ ૧ થી ૮ સુધીના અભ્યાસ માટે વાર્ષિક રૂ.૫૦૦ ની શિષ્યવૃત્તિ મળે છે. આજ પ્રમાણે અમુક શરતોને આધિન,

ધોરણ ૮ થી ઉપર ઉચ્ચ શિક્ષણ મેળવતા અપગ વિદ્યાર્થીને વાર્ષિક રૂ.૮૫૦ થી રૂ.૩૪૦૦ સુધીની શિષ્યવૃત્તિ મળે છે. યુનિવર્સિટીમા અપગ વિદ્યાર્થીઓ માટે ઉ ટકા જગ્યાઓ અનામત રાખવામા આવે છે. ઉ ટકા બેઠકો ઉપર આઈ.ટી.આઈ.ના અભ્યાસ માટે મેરીટના ધોરણે પ્રવેશ આપવામા આવે છે.

હવે આપણે રોજગારીને લગતા લાલો જોઈએ. હા, રોજગારી એ આજના સમયનો વિકરાળ પ્રશ્ન છે. તેમાંથી ભારત જેવા વિક્રમજનક વસ્તી ધરાવતા દેશમા રોજગારી મેળવવી કેટલી અઘરી છે તેનો તો તમને ય અનુભવ થઈ ગયો હશે. રોજગારી મેળવવામા મદદરૂપ થવાના હેતુથી ભારત સરકારે કેટલાક લાલો જાહેર કર્યા છે. જે આ પ્રમાણે છે. જમીન ઉપર ઘસડાઈને ચાલતા હોય તેવા અપગ સરકારી કર્મચારીને વ્હીલચેરની સહાય આપવામા આવે છે. ૫૦ ટકાથી વધારે અપગતા ધરાવતી વ્યક્તિને આવકવેરા માટે વાર્ષિક આવકમા રૂ.૪૦,૦૦૦ની કપાત બાદ બાકી રહેલી આવકમાથી રૂ.૪૦,૦૦૦ની વધારાની કપાત, આ ઉપરાત કોઈપણ વ્યવસાયમા રોજગારી મેળવતી, ૪૦ ટકા ઉપર અપગતા ધરાવતી વ્યક્તિને વ્યવસાય વેરો ભરવામા મુક્તિ, સરકારી નોકરીમા અરજી કરવા માટે નિયત થયેલી વય મર્યાદામા અપગો માટે ૧૦ વર્ષની ધૂટછાટ અને સરકારી કચેરીમા વર્ગ-ઉ અને વર્ગ-ઝની જગ્યાઓમા ઉ ટકા જગ્યાઓ અપગો માટે અનામત રાખવામા આવે છે.

સાધન સહાયને લગતા લાલોમા સરકાર દ્વારા અપગ વ્યક્તિને બે પેડાની સાયકલ, ત્રણ પેડાની સાયકલ, બગલ ધોડી વગેરેની ખરીદી માટે આર્થિક સહાય આપવામા આવે છે. અપગ તથા કાયમી ખોડ ખાપણ ધરાવતા આશ્રિતોની તબીબી સારવાર માટેના ખર્ચ ઉપર ઈન્કમટેક્ષમા રાહત મળે છે. અપગ વ્યક્તિને કૂત્રિમ અવયવ, કેલિપર્સ, ટ્રાયસિકલ વગેરેની ખરીદી પર સેલ્સટેક્ષમા રાહત આપવામા આવે છે.

સરકાર દ્વારા આ બધા લાલો અગેની પુસ્તિકા વિના મુલ્યે આપવામા આવે છે. મને આશા છે કે તમે આમા આપેલી માહીતી નો ભરપૂર શાયદો ઉઠાવશો, મને ખબર છે કે મિત્રો તમે અત્યારે એમ જ વિચારતા હશે કે આ બધું કોણ કરે? એ તે કઈ સહેલી વાત છે? પણ ના, કઈક ઉપયોગી મેળવવા માટે થોડી મહેનત તો કરવી જ પડે ને?

આ લાલો મેળવવા માટે પણ સરકારે કેટલીક વિધિઓ પુરી કરવાનો નિયમ રાખ્યો છે. તમારામાથી ધજાને આ વિધિઓ પુરી કરવામા ધજી તકલીફો પડતી હોય છે ખરૂ ને? તો જુઓ હું તમને કહુ કે આ તકલીફાનો ઉપાય શુ હોઈ શકે? સૌથી પહેલા તો કોઈ પણ લાલ મેળવવામા જરૂરી એવું ડિસેલીલીટી સર્ટીફિકેટ તમારે લેતું પડે. આ સર્ટીફિકેટ જે તે શહેર/જલ્લાના સિવીલ સર્જન દ્વારા આપવામા આવે છે. અમદાવાદ શહેરના રહેવાસીઓને આ સર્ટીફિકેટ સિવીલ હોસ્પિટલ મેધાષીનગરમા

સિવીલ સર્જન દ્વારા મળી શકે, જ્યારે અમદાવાદ તાલુકાના રહીશોને આ સર્ટીફીકેટ સેલારોડ ૫૨ આવેલી સિવીલ હોસ્પિટલમાથી મળી શકે. આ માટે અપગ વ્યક્તિત્વે રૂબરૂમા સિવીલ હોસ્પિટલ જઈને ઓપીડી વિભાગમા સર્ટીફીકેટ મેળવવા માટેનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ત્યારબાદ નબર આવે ત્યારે ઓક્ટેર દ્વારા તપાસી લીધા પછી સર્ટીફીકેટ અપાય છે.

આ સર્ટીફીકેટ એક ખુબ અગત્યનો દસ્તાવેજ છે. તેના દ્વારા તમે ઈન્કમટેક્ષમા રાહત કે એવા બીજા લાભો મેળવી શકો છો. પરંતુ અપગતાનું ઓળખપત્ર મેળવવા માટે આ સર્ટીફીકેટ લીધા બાદ થોડી બીજી કાર્યવાહી પણ કરવાની હોય છે. આ માટે સમાજસુરક્ષા ખાતું, લાલદરવાજાથી તમારે એક ફાર્મ લઈ આવવાનું હોય છે. આ ફાર્મ સાથે તમારા પાસપોર્ટ સાઈઝના ત્રણ ફોટો ઉપરાત નીચે જણાવેલા ત્રણ દસ્તાવેજો લઈ જવાના હોય છે.

૧. રેશનકાર્ડ      ૨. ડોમ્બિસાઈલ એટલે કે નાગરીકત્વનું સર્ટીફીકેટ      ૩. આવકનું પ્રમાણપત્ર.  
આ પ્રમાણે આખું ફાર્મ ભરીને / તેયાર કરીને આપવાથી થોડા દિવસ પછી ઓળખપત્ર મળે છે. આ ફાર્મ આપવા જવાનું સ્થળ બની શકે કે, તમારા ઘરથી ઘણું દૂર આવેલું હોય કે પછી તમારી એવી મુશ્કેલી હોય કે ફરજ પરના અધિકારી તમને સહકાર નથી આપતા, તો એ માટે તમે ફાર્મ વિશેની બધી બાબતો ધ્યાનમા રાખીને, જરૂરી તમામ કાગળો સાથે લઈને, ફાર્મ પુરેપુરું ભરીને જ જશો. શિસ્તપુર્વક લાઈનમા ઉભા રહીને વારો આવે તેની રાહ જોશો. તો તમારા અડધા પ્રશ્નો કે મુશ્કેલીઓ દુર થઈ જશે.

આમ, સરકાર દ્વારા અપગોને અપાતા લાલ મેળવવા એ દરેક અપગ વ્યક્તિનો હક્ક છે. અને બને તેટલો તેનો દરેક અપગ વ્યક્તિએ ઉપયોગ કરવો જોઈએ. આ લાભો દર્શાવતી જે પુસ્તિકા સરકારે બહાર પાડી છે તેમા દરેકે દરેક લાલ દર્શાવ્યા છે. અને તેની વિધિઓ પણ જણાવી છે. ઉપરાત આ પુસ્તિકા સમાજ સુરક્ષા ખાતું, લાલદરવાજા પરથી વિનામુલ્યે મળે છે. તો તેને સાચવીને રાખશો અને તેને વાચીને લાભોનો મહત્તમ ઉપયોગ કરશો.

હું આપણે બીજા અગત્યના મુદ્રા પર આવીએ તો તે છે, ગ્રાહકના હક્કોનો મુદ્રા. આપણે બધા ગ્રાહકો છીએ. જે વ્યક્તિ ખરીદી કરે, ખરીદેલી વસ્તુનો ઉપયોગ કરે તે વ્યક્તિ ગ્રાહક કહેવાય બરાબરને? તમને કોઈ એવો પ્રસગ યાદ છે જેમા એક ગ્રાહક તરીકે કોઈ તમને સત્તોધજનક પરીક્ષામ ન નથ્યુ હોય? કે ખરીદેલી વસ્તુ ખરાબ નીકળી હોય કે તેની પસંદગી અગે અફ્સોસ થયો હોય?

હા, આવા ઘણા બધા અનુભવો મને અને તમને એક ગ્રાહક તરીકે થયા હોય છે. પણ તે કેમ થયા? તેના માટે આપણે શું કર્યું? એતુ કયારેય તમે વિચાર્યું છો? કદાચ નહીં. તો ચાલો આજે હું તમને વિચારવા માટે કઈ વિચારો પુરા પાડુ. ગ્રાહક તરીકે આપણને મૂળજુત રીતે આઠ અધિકારો અત્યારે

મળે છે. સૌ પ્રથમ આ અધિકારો અમેરીકાના પ્રમુક જહેન એફ. કેનેડીએ પ્રસ્તુત કર્યા હતા. હાલમા જે આઠ ગ્રાહકના હક્કોના આપણે અધિકારી છીએ તે આ પ્રમાણે છે,

- |                            |                     |                        |
|----------------------------|---------------------|------------------------|
| ૧. મુખભૂત જરૂરીયાતોનો હક્ક | ૨. પસદગીનો હક્ક.    | ૩. સુરક્ષાનો હક્ક      |
| ૪. માણીતીનો હક્ક           | ૫. ફરીયાદનો હક્ક    | ૬. કાર્તિપૂર્તિનો હક્ક |
| ૭. ગ્રાહક શિક્ષણનો હક્ક    | ૮. પર્યાવરણનો હક્ક. |                        |

મુખભૂત જરૂરીયાતના હકમા રોજબરોજની વસ્તુઓ કે સેવાએ જેના વગર આપણું જીવન શક્ય જ નથી. તેનો સમાવેશ થાય છે. ઉદાહરણ રૂપે, ખોરાક, રહેઠાળ, વસ્ત્ર, સ્વાસ્થ્ય, શિક્ષણ વગેરે. દેશના દરેક નાગરીકનો આ જરૂરીયાતો મેળવવાનો અધિકાર છે.

આજના તીવ્ર હરીકાઈવાળા જમાનામા પસદગીનો અધિકાર ખૂબ કાર્યશીલ બની રહે છે. પસદગીનો અધિકાર આપણને સૂચવે છે કે કોઈપણ વસ્તુ કે સેવાના ક્ષેત્રમા આપણને વસ્તુની ગુણવત્તા અને બીજા અનેક પાસાઓની વિવિધતા ઉપલબ્ધ હોવી જોઈએ, જેના દ્વારા ગ્રાહક યોગ્ય નિર્ણય લઈને યોગ્ય વસ્તુની પસદગી કરી શકે. બધા અધિકારોમા આ અધિકારને આધારભૂત ગણ્ણાવી શકાય કારણે આનાથી હરીકાઈને કારણે વસ્તુની કિમત ઉપર કંઈક અશે નિયતપણ રહે છે. ઘણી વખત આપણી જાણ બધાર આ પસદગીના હકનું ઉત્ત્વધન થતું હોય છે. જેમકે, દુકાનદાર જ્યારે કોઈપણ વસ્તુ ખરીદવા માટે દબાણ કરે અને તમારી ઈચ્છા ન હોવા છતા પણ તમે જ્યારે દબાણને વશ થઈને કે એ જ વસ્તુ ખરીદો છો ત્યારે તમારા પસદગીના અધિકારનું ઉત્ત્વધન થાય છે. આપણે એક જાગૃત ગ્રાહક હોવાને નાતે આપણા પસદગીના હકકનો હમેશા ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને વીમા કંપની, ઇલેક્ટ્રીસિટી કંપની, રેલ્વે, ટોકટરો કે વકીલો જેવા વ્યવસાયિક ક્ષેત્રે મોનોપોલી કે એકાભિકાર ચાલતો હોય ત્યારે.

આવો જ બીજો એક અધિકાર છે, સુરક્ષાનો અધિકાર. જીવનમા દુર્ઘટના થાય તે ઘણી દુઃખદાયક વાત છે. ઉત્પાદકો પોતાની વસ્તુઓની ગુણવત્તાની કાળજી રાખે તો ઘણી દુર્ઘટના એ નિવારી શકાય છે. પ્રેશર ફુકર, ઇસ્ટ્રી, ગેસનો બાટલો, સ્ટ્ર્યુ, મિક્સર, ગ્રાઇનર વગેરે જોવી અનેક વસ્તુઓ જો ખામીવાળી નીકળે તો તે ગ્રાહકના જીવન માટે ઘણી જોખમી પુરવાર થઈ શકે છે. ઉત્પાદનકર્તાઓએ વસ્તુની ઉત્પાદન સમયે વસ્તુની ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખતું જોઈએ. જેથી ગ્રાહકને સુરક્ષા મળે, કોઈપણ વસ્તુ કે સેવાઓમા રહેલા જોખમી પરિબળો અગે ગ્રાહકને સાવચેત કરવા જોઈએ. આપણે જીવનમા ઘણી બધી એવી વસ્તુઓ વાપરીએ છીએ, જેનાથી આપણા સ્વાસ્થ્ય અથવા જીવનને નુકસાન થઈ શકે છે. આપણા આ અધિકારને ધ્યાનમા લઈને સરકારે કેટલીક કાનૂની જોગવાઈ કરી છે. જેમકે, ઘરેલું ઇલેક્ટ્રીક

ઉપકરણો માટે ISI માર્ક, ખાદ્ય પદાર્થો માથે FPO માર્ક વગેરે આપણને સારી ગુજરાતીની ખાતરી કરાવે છે.

માહીતીનો હક્ક એ એક એવો અગત્યનો હક્ક છે કે જેના વગર બીજા બધા હક્કો અર્થહીન બની જાય છે. કોઈપણ વસ્તુની પસંદગી કરતા પણેલા ગ્રાહકો પાસે તેની વિસ્તૃત અને સાચી માહીતી ઉપલબ્ધ હોવી જોઈએ. વસ્તુની ગુજરાતી, માત્રા, ડિમાન્ડ વગેરે અંગેની માહીતી ગ્રાહકો સુધી પણેચાડવી એ ઉત્પાદકોની જવાબદારી છે. જરૂરી માહીતી વડે ગ્રાહક ખરીદી અગેનો સાચો નિર્જય કરી શકે છે. શું તમે જાણો છો? આપણે આવી માહીતી ક્યાથી મેળવી શકીએ?

હા, સાચી વાત. વસ્તુ પરના લેબલ પરથી સેલ્ફ્બેન કે દુકાનદાર પાસેથી રેમજ જાહેરખબરો દ્વારા માહીતી એકઢી કરી શકાય. જાહેરખબરો મોટે ભાગે વસ્તુ અન તેની ગુજરાતી અગે આપણને જેરમાર્ગ દેારે છે. (ઉદાહરણ આપવું). ગ્રાહકોએ જાહેરખબરોની આવી ભાવનાઓક જાળમા ફસાઈ ન જવું જોઈએ અને પોતાની તટસ્ય દ્રષ્ટિથી નિર્જય કરવો જોઈએ.

ફરિયાદનો અધિકાર આપણને સૂચવે છે કે આપણા કોઈપણ અસ્તોષ માટે દુકાનદારથી માડીને ઉત્પાદનકર્તા સુધી કોઈને પણ ફરિયાદ કરવાનો આપણો અધિકાર છે. ભારતીય ગ્રાહકોની એ જૂની આદત છે કે એ પોતાને થતા અન્યાય ચૂપચાપ સહન કરી લે છે. અને બને ત્યા સુધી તે ફરિયાદ કરતે નથી. આમ ન બનવા દેતા દરેક વ્યક્તિને પોતાને થયેલા નાના અમદા અન્યાય સામે પણ જાગૃત થઈને અવાજ ઉઠાવવો જોઈએ અને તે અગે દુકાનદાર કે વેચનાર સાથે વાત કરવી જોઈએ.

આના સહધમા એક બીજો અધિકાર ગ્રાહકોને છે તે છે, ક્ષતિપૂર્તિનો અધિકાર એટલે કે વળતરનો અધિકાર. ગ્રાહકોને પોતાની ફરિયાદ અગે ન્યાયિક ચુકાદા મળવો જરૂરી છે. ગ્રાહકને ખરાબ કે નુકસાનીવાળા માલનું વળતર કે અસ્તોષકારક સેવાઓ સામેનું વળતર મેળવવાનો અધિકાર છે. આવા કે ચુકાદાઓ માટે સરકારે ગ્રાહક સુરક્ષા ધારા અત્યર્ગત તકરાર નિવારણ માટે ત્રણ માળખાની ન્યાયિક ચુકાદાઓ માટે સરકારે ગ્રાહક સુરક્ષા ધારા કે જે કન્ફિડ્યુલ પ્રોટેક્શન એકટ તરીકે પણ નિવારણ કરી શકાય છે. આ માટે ગ્રાહક સુરક્ષા ધારા કે જે કન્ફિડ્યુલ પ્રોટેક્શન એકટ તરીકે પણ જાણીતો છે, તે ઘણો ઉધ્યોગી છે. આના અત્યર્ગત હવે કોઈપણ તકરારનું નિવારણ હવે ત્રણ મહીનામા થઈ જવું જોઈએ.

આપણે આ કાયદાકીય મદદનો લાલ લઈને આપણને થતા અન્યાયનો સામનો કરવો જોઈએ. કોઈપણ એક જાગૃત ગ્રાહક ધારા આપા સમાજને કાયદો થઈ શકે છે. પણ ત્થા, વળતરનો લાલ લેવા માટે આપણે ખરીદી કર્યાનું બીલ કે રીસીપી લેવાનું ન ભૂલતું જોઈએ.

આ ઉપરાત આપણે ગ્રાહક શિક્ષણના પણ અધિકારી છીએ. દરેક વ્યક્તિને એક સારા ગ્રાહક તરીકે વર્તતા આવડવું જોઈએ. આપણને ગ્રાહકના હક્કો અને ફરજો વિશેનું જ્ઞાન હોવું જોઈએ. અને આપણે તે મેળવવાના પ્રયત્નો પણ કરવા જોઈએ. વળી આ જ્ઞાન મેળવીને તેનો ઉપયોગ પણ કરવો જોઈએ અને જ્ઞાનની વહેચણી પણ કરવી જોઈએ.

સ્વસ્થ પર્યાવરણના હક્કોનો અર્થ છે કે દરેકને શુધ્ય વાતાવરણ મળવું જોઈએ. ચોખ્ખી હવા, પાણી અને બીજા કુદરતી તત્વોને આપણે જાળવી રાખવા જોઈએ. જેથી આવનારી પેઢીને પણ આપણે સ્વસ્થ પર્યાવરણ આપી શકીએ. હા, સ્વસ્થ પર્યાવરણ એ એમનો પણ અપિકાર છે.

આપણે ગ્રાહકોએ એક જાગૃત ગ્રાહક બનવું જરૂરી છે. દુકાનદાર પર જરૂર કરતો વધારે વિશ્વાસ ઘાતક નીવડી શકે છે. કારણું તેઓના નજીબું પલહુ તો હમેશાં નમેલું જ રહેતું હોય છે. તમે વિચારશો કે આટલા બધા ગ્રાહકોની ફુનિયામા એક ગ્રાહકના અવાજનું શુ જોાર? આવા સમયે ગ્રાહક સંગઠનો ઉપયોગી બને છે. આપણે આવા ગ્રાહક સંગઠનો ની મુલાકાત લેવી જોઈએ, તેના સત્ય બનવું જોઈએ અને જરૂર પડ્યે મદદ પણ લેવી જોઈએ.

મિત્રો, હવે જ્યારે આપણે ગ્રાહક ના હક્કો વિશેની જાણકારી મેળવી છે તો તમે મને વચ્ચન આપો કે તમે આ જ્ઞાનનો ઉપયોગ કરશો કે જેથી કરીને બેઇમાન દુકાનદાર આપણી જેવા ગ્રાહકોને છેતરી ન શકે.